



# ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.

## [ સેવિંગ્સ ]

તારીખ

ખાતા નંબર.

મહેરબાની કરી મારૂ / અમારૂ ખાતુ આપની

શાખામાં ખોલી આપવા વિનંતી.

### વ્યક્તિગત માહિતી

શિર્ષક	પ્રથમ નામ	મધ્ય નામ	અટક				
મુખ્ય અરજદાર	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	
સંયુક્ત નં.1	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	
સંયુક્ત નં.2	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	
જન્મ તારીખ	જાતિ	પરણિત	માઈનોર	પાન નંબર	<input checked="" type="checkbox"/> કરો		
મુખ્ય અરજદાર	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	ફોર્મ 60/61	
સંયુક્ત નં.1	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	ફોર્મ 60/61	
સંયુક્ત નં.2	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	ફોર્મ 60/61	
આપ બેંકના જૂના ગ્રાહક છો, હા તો ખાતા નં.	પગારદાર	સે.એમ્પ્લો.	ધંધો	નિવૃત્ત	વિદ્યાર્થી	ધરકામ	અન્ય
મુખ્ય અરજદાર	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
સંયુક્ત નં.1	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
સંયુક્ત નં.2	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>

### સરનામાની વિગત

પત્ર વ્યવહારનું	<input type="text"/>		
સરનામું	<input type="text"/>		
ગામ	<input type="text"/>		
રાજ્ય	<input type="text"/>		
દેશ	<input type="text"/>		
પીનકોડ	<input type="text"/>		
કાયમી	<input type="checkbox"/> ઉપર મુજબ		
સરનામું	<input type="text"/>		
ગામ	<input type="text"/>		
રાજ્ય	<input type="text"/>		
દેશ	<input type="text"/>		
પીનકોડ	<input type="text"/>		
STD કોડ	ફોન (ઓફિસ)	ફોન (ઘર)	ફેક્સ
મુખ્ય અરજદાર	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
સંયુક્ત નં.1	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
સંયુક્ત નં.2	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
મોબાઈલ નંબર	ઈ-મેઈલ આઈ.ડી.		
મુખ્ય અરજદાર	<input type="text"/>		
સંયુક્ત નં.1	<input type="text"/>		
સંયુક્ત નં.2	<input type="text"/>		
અંકે રૂપિયા	<input type="text"/>		
રોકડા	<input type="checkbox"/>		
ટ્રાન્સફર મારા ખાતા નં.	<input type="text"/>		
માંથી ચેક નં.	<input type="text"/>		
તા.	<input type="text"/>		
બેંક	<input type="text"/>		
શાખાનો મારા/અમારા	<input type="text"/>		
ખાતામાં જમા કરવા વિનંતી.	<input type="text"/>		

જો ચેક દ્વારા ખાતુ ખોલાવવાનું હોય તો એકાઉન્ટ પેઈ ચેક 'ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.- અરજદારનું નામ' ના નામનો અરજદાર પોતે સાર્દન કરેલો જ સ્વિકારવામાં આવશે.) ચેકબુકની જરૂરીયાત છે

### જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના વર્તમાન ગ્રાહક દ્વારા ઓળખાણ

હું ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના છ માસથી વધુ સમય પહેલાનો ખાતા ધારક છું. હું અરજદારને છેલ્લા  સમયથી ઓળખું છું. તથા તેઓ દ્વારા ખાતુ ખોલાવવા માટેની અરજ સાથે જોડેલા તેઓના દસ્તાવેજથી હું માહિતગાર છું. તેની ખાત્રી આપુ છું. ઓળખાણ આપનારા ના ખાતા નં.

ઓળખાણ આપનારનું નામ

ઓળખાણ આપનારની સહી

ઓળખાણ આપનારની સહી યકાસણી કરનાર

બેંક અધિકારીની સહી તથા કોડ

## તમારા ગ્રાહકને ઓળખાવો (KYC) માટેની વિગત

પુરાવાઓ રજુ કરેલ છે (વેરીફાઇ માટે અસલ પુરાવા સાથે રાખવા જરૂરી છે)

વ્યક્તિગત પુરાવાની વિગત (Identity)

પુરાવા નંબર

ઓથોરીટી

ઈસ્યુ થયેલ સ્થળ

મુખ્ય અરજદાર





સંયુક્ત નં.1





સંયુક્ત નં.2





રહેઠાણના પુરાવાની વિગત (Address)

પુરાવા નંબર

ઓથોરીટી

ઈસ્યુ થયેલ સ્થળ

મુખ્ય અરજદાર





સંયુક્ત નં.1





સંયુક્ત નં.2





મુખ્ય અરજદારની પ્રાથમિક વિગતો:-

ધર્મ:-	<input type="checkbox"/> હિન્દુ	<input type="checkbox"/> મુસ્લિમ	<input type="checkbox"/> શીખ	<input type="checkbox"/> ઈસાઈ	<input type="checkbox"/> અન્ય
અનામત વર્ગી	<input type="checkbox"/> અનુ. જાતિ	<input type="checkbox"/> અનુ. જનજાતિ	<input type="checkbox"/> બક્ષીપંચ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>	<input type="checkbox"/> લાગુ પડતુ નથી.
અભ્યાસ:-	<input type="checkbox"/> અભાણ	<input type="checkbox"/> નોન મેટ્રીક	<input type="checkbox"/> અન્ડર ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>
નોકરીદાતા:-	<input type="checkbox"/> પબ્લીક લી.કંપની	<input type="checkbox"/> પ્રાઇવેટ લી.કંપની	<input type="checkbox"/> સરકારી ખાતુ	<input type="checkbox"/> મલ્ટીનેશનલ કંપની	<input type="checkbox"/> સંસ્થા
વ્યવસાયીક:-	<input type="checkbox"/> ચાર્ટડ એકાઉન્ટન્ટ	<input type="checkbox"/> એન્જનીયર	<input type="checkbox"/> ડોક્ટર	<input type="checkbox"/> પ્રોપ્રાઇટરશીપ	<input type="checkbox"/> ભાગીદારી
માસિક આવક:-	<input type="checkbox"/> 25000 સુધી	<input type="checkbox"/> 25001-50000	<input type="checkbox"/> 50001-100000	<input type="checkbox"/> 100001-500000	<input type="checkbox"/> 500000 થી વધુ
રહેણાંક	<input type="checkbox"/> માલિકીનું	<input type="checkbox"/> ભાડા પટેથી	<input type="checkbox"/> ગર્વમેન્ટ ક્વાર્ટર	<input type="checkbox"/> અન્ય	
પરણિત	<input type="checkbox"/> હા	<input type="checkbox"/> ના	જો હા તો જીવનસાથીનું નામ:- <input type="text"/>		

બાળકો:-

નામ

જાતિ

જન્મ તારીખ

1	<input type="text"/>
2	<input type="text"/>
3	<input type="text"/>

M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y

સંયુક્ત-1 અરજદારની પ્રાથમિક વિગતો:-

ધર્મ:-	<input type="checkbox"/> હિન્દુ	<input type="checkbox"/> મુસ્લિમ	<input type="checkbox"/> શીખ	<input type="checkbox"/> ઈસાઈ	<input type="checkbox"/> અન્ય
અનામત વર્ગી	<input type="checkbox"/> અનુ. જાતિ	<input type="checkbox"/> અનુ. જનજાતિ	<input type="checkbox"/> બક્ષીપંચ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>	<input type="checkbox"/> લાગુ પડતુ નથી.
અભ્યાસ:-	<input type="checkbox"/> અભાણ	<input type="checkbox"/> નોન મેટ્રીક	<input type="checkbox"/> અન્ડર ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>
નોકરીદાતા:-	<input type="checkbox"/> પબ્લીક લી.કંપની	<input type="checkbox"/> પ્રાઇવેટ લી.કંપની	<input type="checkbox"/> સરકારી ખાતુ	<input type="checkbox"/> મલ્ટીનેશનલ કંપની	<input type="checkbox"/> સંસ્થા
વ્યવસાયીક:-	<input type="checkbox"/> ચાર્ટડ એકાઉન્ટન્ટ	<input type="checkbox"/> એન્જનીયર	<input type="checkbox"/> ડોક્ટર	<input type="checkbox"/> પ્રોપ્રાઇટરશીપ	<input type="checkbox"/> ભાગીદારી
માસિક આવક:-	<input type="checkbox"/> 25000 સુધી	<input type="checkbox"/> 25001-50000	<input type="checkbox"/> 50001-100000	<input type="checkbox"/> 100001-500000	<input type="checkbox"/> 500000 થી વધુ
રહેણાંક	<input type="checkbox"/> માલિકીનું	<input type="checkbox"/> ભાડા પટેથી	<input type="checkbox"/> ગર્વમેન્ટ ક્વાર્ટર	<input type="checkbox"/> અન્ય	
પરણિત	<input type="checkbox"/> હા	<input type="checkbox"/> ના	જો હા તો જીવનસાથીનું નામ:- <input type="text"/>		

બાળકો:-

નામ

જાતિ

જન્મ તારીખ

1	<input type="text"/>
2	<input type="text"/>
3	<input type="text"/>

M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y

સંયુક્ત-2 અરજદારની પ્રાથમિક વિગતો:-

ધર્મ:-	<input type="checkbox"/> હિન્દુ	<input type="checkbox"/> મુસ્લિમ	<input type="checkbox"/> શીખ	<input type="checkbox"/> ઈસાઈ	<input type="checkbox"/> અન્ય
અનામત વર્ગી	<input type="checkbox"/> અનુ. જાતિ	<input type="checkbox"/> અનુ. જનજાતિ	<input type="checkbox"/> બક્ષીપંચ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>	<input type="checkbox"/> લાગુ પડતુ નથી.
અભ્યાસ:-	<input type="checkbox"/> અભાણ	<input type="checkbox"/> નોન મેટ્રીક	<input type="checkbox"/> અન્ડર ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ	<input type="checkbox"/> અન્ય <input type="text"/>
નોકરીદાતા:-	<input type="checkbox"/> પબ્લીક લી.કંપની	<input type="checkbox"/> પ્રાઇવેટ લી.કંપની	<input type="checkbox"/> સરકારી ખાતુ	<input type="checkbox"/> મલ્ટીનેશનલ કંપની	<input type="checkbox"/> સંસ્થા
વ્યવસાયીક:-	<input type="checkbox"/> ચાર્ટડ એકાઉન્ટન્ટ	<input type="checkbox"/> એન્જનીયર	<input type="checkbox"/> ડોક્ટર	<input type="checkbox"/> પ્રોપ્રાઇટરશીપ	<input type="checkbox"/> ભાગીદારી
માસિક આવક:-	<input type="checkbox"/> 25000 સુધી	<input type="checkbox"/> 25001-50000	<input type="checkbox"/> 50001-100000	<input type="checkbox"/> 100001-500000	<input type="checkbox"/> 500000 થી વધુ
રહેણાંક	<input type="checkbox"/> માલિકીનું	<input type="checkbox"/> ભાડા પટેથી	<input type="checkbox"/> ગર્વમેન્ટ ક્વાર્ટર	<input type="checkbox"/> અન્ય	
પરણિત	<input type="checkbox"/> હા	<input type="checkbox"/> ના	જો હા તો જીવનસાથીનું નામ:- <input type="text"/>		

બાળકો:-

નામ

જાતિ

જન્મ તારીખ

1	<input type="text"/>
2	<input type="text"/>
3	<input type="text"/>

M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y
M	F	D	D	M	M	Y	Y	Y	Y

ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના ખાતુ ખોલવા અને ચલાવવા માટેના નિયમો, શરતો મેં વાંચ્યા છે અને સમજ્યા છે અને તે મને/અમોને બંધનકર્તા છે. હું/અમો અમારા ખાતામાં બેંકના વખતો વખતના દરોએ ચાર્જસ/સર્વિસ ચાર્જસ/ટેક્સની રકમની વસુલાતને કબુલ રાખું છું/છીએ હું/અમો સમજીએ છીએ/સ્વિકારીએ છીએ કે બેંક પોતાના વિવેકાધીન આ ખાતુ મને/અમોને કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર બંધ કરવા અથવા મારા/અમારા ખાતામાં અપાતી સેવાઓમાંથી અમુક સેવાઓ રદ કરવા અધિકૃત છે. મારા/અમારા ખાતામાંથી ફંડના અભાવે અવાર નવાર ચેક રીટર્ન થશે તો બેંક દ્વારા મને/અમોને કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર ખાતુ બંધ કરવા બેંક અધિકૃત છે. હું / અમો બેંકના વખતો વખતના નિયમ અનુસાર મીનીમમ બેલેન્સ તેમજ ત્રીમાસિક/વાર્ષિક/એવરેજ બેલેન્સ રાખવા સહમત છીએ / અમોને મંજૂર છે.

હું/અમો ખાત્રી આપીએ છીએ કે અમે ભારતના રહેવાસી છીએ. હું/અમો અહી જાહેર કરીએ છીએ કે અહી ભરવામાં / પુરી પાડવામાં આવેલી માહિતી સાચી અને યોગ્ય છે. જે મારી/અમારી જાણમાં છે.

<b>મુખ્ય અરજદારનો તાજેતરનો ફોટોગ્રાફ લગાવી તેના પર સહી કરવી</b>	<b>સંયુક્ત-1 અરજદારનો તાજેતરનો ફોટોગ્રાફ લગાવી તેના પર સહી કરવી</b>	<b>સંયુક્ત-2 અરજદારનો તાજેતરનો ફોટોગ્રાફ લગાવી તેના પર સહી કરવી</b>	
<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	<input type="checkbox"/>
<b>ખાતુ</b> <input type="checkbox"/> સ્વયં પોતે	<input type="checkbox"/> પ્રથમ નામ ધારક અથવા હયાત	<input type="checkbox"/> સંયુક્ત રૂપે બંધા જા અથવા હયાત	
<b>ચલાવવાની રીત</b> <input type="checkbox"/> બે માંથી કોઈપણ એક અથવા હયાત	<input type="checkbox"/> કોઈપણ એક અથવા હયાત માંથી એક	<input type="checkbox"/> સગીર નામે તેમના વાલી	<input type="checkbox"/> અન્ય રીતે
<b>અન્ય હોય તો જણાવવી</b> <table border="1" style="width:100%; height: 20px; border-collapse: collapse;"></table>			

**બેંકના અધિકૃત અધિકારીની સહી**

તારીખ:

કર્મચારી કોડ:

**નોમીનેશન વિગત (ફોર્મ નં.ડી-1)**

બેંકમાં મુકેલી થાપણો સંદર્ભ બેંકીંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ નં.45-ZA અને બેંકીંગ કંપની (નોમીનેશન) નિયમ 1985 હેઠળ નિમાણકની વિગત

હું / અમો

સરનામું

નીચે દર્શાવેલ વ્યક્તિની નોમીની તરીકે નિમાણક કરૂ છું / કરીએ છીએ. અમારા આ ખાતામાં રહેલી ડીપોઝીટ (જમારાશી) મારા/અમારા સગીરના મૃત્યુ પછી નીચે દર્શાવેલ વ્યક્તિને ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. એ પરત ચૂકવવા.

નામ

સરનામું :-  પ્રાથમિક અરજદારના સરનામા મુજબ  જો પ્રાથમિક અરજદારના સરનામાથી અલગ હોય તો નીચે જણાવવું

સરનામું

થાપણદાર સાથેનો સંબંધ  ઉંમર  વર્ષ, જો નિમાયેલ વ્યક્તિ સગીર હોય તો જન્મતારીખ

નિમાયેલ વ્યક્તિ આજની તારીખે સગીર હોય, હું/અમો (નામ)

સગીર સાથેનો સંબંધ  સરનામું :-  પ્રાથમિક અરજદારના સરનામા મુજબ  જો પ્રાથમિક અરજદારના સરનામાથી અલગ હોય તો જણાવવું

ને સગીર વતી થાપણની રકમ મારા/અમારા/સગીરના મૃત્યુના સંજોગોમાં સગીરની સગીર અવસ્થા સુધી મેળવવા નોમીની તરીકે નિયુક્ત કરૂ છું / કરીએ છીએ

સાક્ષીની સહી <input checked="" type="checkbox"/> <input style="width: 100%;" type="text"/>	મુખ્ય અરજદાર <input checked="" type="checkbox"/> <input style="width: 100%;" type="text"/>
નામ <input style="width: 100%;" type="text"/>	નામ <input style="width: 100%;" type="text"/>
સરનામું <input style="width: 100%;" type="text"/>	સરનામું <input style="width: 100%;" type="text"/>
તારીખ:- <input style="width: 100%;" type="text"/> સ્થળ:- <input style="width: 100%;" type="text"/>	તારીખ:- <input style="width: 100%;" type="text"/> સ્થળ:- <input style="width: 100%;" type="text"/>

સંયુક્ત-1 અરજદારની સહી

સંયુક્ત-2 અરજદારની સહી

**બેંક ઉપયોગ માટે**

**રીસ્ક લેવલ**  લેવલ-1  લેવલ-2  લેવલ-3  લાગુ પડતુ નથી.

હું આથી પ્રમાણિત કરી આપુ છું કે KYC માટેના જરૂરી દસ્તાવેજ મારા દ્વારા મેળવીને ચકાસણી કરવામાં આવી છે. બેંકની જરૂરીયાત પ્રમાણેના KYC દસ્તાવેજ પર્યાપ્ત છે તેની ખાત્રી આપું છું તથા અરજદારોના નામોનો યુનાઈટેડ નેશન-સ દ્વારા જારી કરાયેલા આંતરક્રવાદી / ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિધ્ધ કરાયેલી માર્ગદર્શિકાની કાચી યાદીમાં સમાવેશ થયેલ નથી તેની તકેદારી લેવામાં આવી છે. આ આધાર ઉપર ખાતુ ખોલવાની મંજૂરી આપવામાં આવે છે.

શાખા મેનેજર / ઓફિસરનું નામ:-  શાખા

કર્મચારીનો કોડ નંબર:  તારીખ:-  સહી:-

**મુખ્ય અરજદાર ફોર્મ નં.60**

**જેઓ PAN અને GIR નંબર ધરાવતા નથી અને આવકવેરા કાયદાના નિયમ નંબર 114B ની ક્લમ (એ) થી (એચ) માં દર્શાવેલા વ્યવહારો સંબંધમાં રોકડમાં ચુકવણી કરતા હોય તેઓ દ્વારા ભરવાનું થતું એકરાર પત્ર.**

1 જાહેર કરનારનું નામ તથા સરનામું \_\_\_\_\_

2 વ્યવહારની વિગતો:- \_\_\_\_\_ વ્યવહારની રકમ રૂ. \_\_\_\_\_

4 ટેક્ષ માટે આકારણી પામ્યા છો  હા  ના

5 જો હા તો (1) છેલ્લે આવકનું રીટર્ન જ્યાં ફાઇલ કરાવ્યું હોય તે વોર્ડ / સર્કલ / વિસ્તારની વિગતો દર્શાવો. \_\_\_\_\_

(2) પાન નં./ઈન્ડેક્સ રજીસ્ટર નંબર ના ધરાવવાનું કારણ \_\_\_\_\_

કોલમ (1) મુજબન સરનામાંના પુરાવારૂપે રજુ કરેલ દસ્તાવેજોની વિગતો \_\_\_\_\_

ચોકસાઈ:- હું \_\_\_\_\_ આ સાથે જાહેર કરું છું કે ઉપર જે દર્શાવેલ છે તે મારી જાણ અને માન્યતા અનુસાર સાચું છે. આજ \_\_\_\_\_ વાર અને તારીખ \_\_\_\_\_

સ્થળ:- \_\_\_\_\_ તારીખ:- \_\_\_\_\_

**જાહેર કરનારની સહી**  
**'ફોર્મ નં.61 લાગુ પડતું હોય તેઓએ આ ફોર્મ પણ ભરી આપવું'**

**મુખ્ય અરજદાર ફોર્મ નં.61**

**જેઓ કૃષિ વિષયક આવક ધરાવતા હોય અને બીજા અન્ય આવક આવકવેરા પાત્ર થતી ન હોય અને આવકવેરા કાયદાના નિયમ નંબર 114B ની ક્લમ (એ) થી (એચ) માં દર્શાવેલા વ્યવહારો કરવાના થતા હોય તેઓ દ્વારા ભરવાનું થતું એકરાર પત્ર**

1 જાહેર કરનારનું નામ તથા સરનામું \_\_\_\_\_

2 વ્યવહારની વિગતો:- \_\_\_\_\_

કોલમ (1) મુજબન સરનામાંના પુરાવારૂપે રજુ કરેલ દસ્તાવેજોની વિગતો \_\_\_\_\_

હું જાહેર કરું છું કે મારી મુખ્ય આવક કૃષિ વિષયક છે અને મારી અન્ય બીજા આવક ઉપર આવકવેરો ભરવાપાત્ર થતો નથી.

ચોકસાઈ:- હું \_\_\_\_\_ આ સાથે જાહેર કરું છું કે ઉપર જે દર્શાવેલ છે તે મારી જાણ અને માન્યતા અનુસાર સાચું છે. આજ \_\_\_\_\_ વાર અને તારીખ \_\_\_\_\_

સ્થળ:- \_\_\_\_\_ તારીખ:- \_\_\_\_\_

**જાહેર કરનારની સહી**

**સંયુક્ત-1 અરજદાર ફોર્મ નં.60**

**જેઓ PAN અને GIR નંબર ધરાવતા નથી અને આવકવેરા કાયદાના નિયમ નંબર 114B ની ક્લમ (એ) થી (એચ) માં દર્શાવેલા વ્યવહારો સંબંધમાં રોકડમાં ચુકવણી કરતા હોય તેઓ દ્વારા ભરવાનું થતું એકરાર પત્ર.**

1 જાહેર કરનારનું નામ તથા સરનામું \_\_\_\_\_

2 વ્યવહારની વિગતો:- \_\_\_\_\_ વ્યવહારની રકમ રૂ. \_\_\_\_\_

4 ટેક્ષ માટે આકારણી પામ્યા છો  હા  ના

5 જો હા તો (1) છેલ્લે આવકનું રીટર્ન જ્યાં ફાઇલ કરાવ્યું હોય તે વોર્ડ / સર્કલ / વિસ્તારની વિગતો દર્શાવો. \_\_\_\_\_

(2) પાન નં./ઈન્ડેક્સ રજીસ્ટર નંબર ના ધરાવવાનું કારણ \_\_\_\_\_

કોલમ (1) મુજબન સરનામાંના પુરાવારૂપે રજુ કરેલ દસ્તાવેજોની વિગતો \_\_\_\_\_

ચોકસાઈ:- હું \_\_\_\_\_ આ સાથે જાહેર કરું છું કે ઉપર જે દર્શાવેલ છે તે મારી જાણ અને માન્યતા અનુસાર સાચું છે. આજ \_\_\_\_\_ વાર અને તારીખ \_\_\_\_\_

સ્થળ:- \_\_\_\_\_ તારીખ:- \_\_\_\_\_

**જાહેર કરનારની સહી**  
**'ફોર્મ નં.61 લાગુ પડતું હોય તેઓએ આ ફોર્મ પણ ભરી આપવું'**

**સંયુક્ત-1 અરજદાર ફોર્મ નં.61**

**જેઓ કૃષિ વિષયક આવક ધરાવતા હોય અને બીજા અન્ય આવક આવકવેરા પાત્ર થતી ન હોય અને આવકવેરા કાયદાના નિયમ નંબર 114B ની ક્લમ (એ) થી (એચ) માં દર્શાવેલા વ્યવહારો કરવાના થતા હોય તેઓ દ્વારા ભરવાનું થતું એકરાર પત્ર**

1 જાહેર કરનારનું નામ તથા સરનામું \_\_\_\_\_

2 વ્યવહારની વિગતો:- \_\_\_\_\_

કોલમ (1) મુજબન સરનામાંના પુરાવારૂપે રજુ કરેલ દસ્તાવેજોની વિગતો \_\_\_\_\_

હું જાહેર કરું છું કે મારી મુખ્ય આવક કૃષિ વિષયક છે અને મારી અન્ય બીજા આવક ઉપર આવકવેરો ભરવાપાત્ર થતો નથી.

ચોકસાઈ:- હું \_\_\_\_\_ આ સાથે જાહેર કરું છું કે ઉપર જે દર્શાવેલ છે તે મારી જાણ અને માન્યતા અનુસાર સાચું છે. આજ \_\_\_\_\_ વાર અને તારીખ \_\_\_\_\_

સ્થળ:- \_\_\_\_\_ તારીખ:- \_\_\_\_\_

**જાહેર કરનારની સહી**